



# ખેલાડી રજીસ્ટ્રેશન ફોર્મ



જીલ્લો :-

નોંધણી ક્રમાંક :-

નોંધ :- સૌ પ્રથમ ફોર્મ ધ્યાનથી વાંચી લેવું, ત્યારબાદ જ ભરવું.

ફોર્મ ક્રમાંક

રમતવીરની મુખભૂત માહિતી :-

અટક

નામ

પિતાનું નામ

પુરુનામ :-				
જન્મ તારીખ :-				
જાતી (સ્ત્રી / પુરુષ):-				
ગુજરાતના વ્યક્તિ છો કે કેમ ?	<input type="checkbox"/> હા	<input type="checkbox"/> ના	ફોટો અહીં લગાડવો	
કેટેગરી (અનામત) :	<input type="checkbox"/> જનરલ	<input type="checkbox"/> ઓબીસી		<input type="checkbox"/> એસ.સી.

ઘરનું સરનામું :-			
ઘરનો ફોન નંબર :-		મોબાઈલ :-	
તાલુકો :-		જીલ્લો :-	
સંસ્થાનું સરનામું :-			
ફોન નંબર :-		મોબાઈલ :-	
તાલુકો :-		જીલ્લો :-	

બાળક કઈ રમતોમાં ભાગ લેવા માંગે છે તેની માહિતી :-

વિભાગ ૧

એથલેટિક્સ હાઇર એબીલીટી

- ૧૦૦ મી દોડ
- ૨૦૦ મી દોડ
- ૪૦૦ મી દોડ
- ૮૦૦ મી દોડ
- લાંબી ફૂદ
- ઊંચી ફૂદ
- ગોળા ફેક
- ૪ X ૧૦૦ રીલે
- ૪ X ૪૦૦ રીલે

વિભાગ ૨

એથલેટિક્સ લોવર એબીલીટી

- ૨૫ મી દોડ
- ૨૫ મી વોક
- ૫૦ મી દોડ
- ૫૦ મી વોક
- ૧૦૦ મી વોક
- સોફ્ટબોલ થ્રો
- સ્ટેંડીંગ લોંગ જમ્પ
- ૨૫ મી બ્હીલચેર રેસ
- ૫૦ મી બ્હીલચેર રેસ

વિભાગ ૩

સાયક્લીંગ

- ૫૦૦ મી ટાઈમ ટ્રાયલ
- ૧ કી.મી. ટાઈમ ટ્રાયલ
- ૫ કી.મી. ટાઈમ ટ્રાયલ
- ૫ કી.મી. રોડ રેસ
- ૧૦ કી.મી. રોડ રેસ



વિભાગ ૪ રોલર સ્કેટીંગ	વિભાગ ૫ સ્વીમિંગ	વિભાગ ૬ રમતો
૧૦૦ મી <input type="radio"/>	૨૫ મી ફ્રિ-સ્ટાઈલ <input type="radio"/> ૫૦ મી ફ્રિ-સ્ટાઈલ <input type="radio"/>	ટેબલ ટેનિસ <input type="radio"/> બાસ્કેટબોલ <input type="radio"/>
૩૦૦ મી <input type="radio"/>	૨૫ મી બેક સ્ટ્રોક <input type="radio"/> ૫૦ મી બેક સ્ટ્રોક <input type="radio"/>	બેડમિન્ટન <input type="radio"/> ફૂટબોલ <input type="radio"/>
૨ X ૧૦૦ રીલે <input type="radio"/>	૨૫ મી બટર ફ્લાય <input type="radio"/> ૫૦ મી બટર ફ્લાય <input type="radio"/>	બોચી <input type="radio"/> હેન્ડબોલ <input type="radio"/>
	૨૫ મી બ્રેસ્ટ સ્ટોક <input type="radio"/> ૫૦ મી બ્રેસ્ટ સ્ટોક <input type="radio"/>	ક્રિકેટ <input type="radio"/> વોલીબોલ <input type="radio"/>
		પાવર-લિફ્ટીંગ <input type="radio"/>

રમતવીર વય જૂથ

જૂનીયર	
૮ થી ૧૧ <input type="text"/>	૧૨ થી ૧૫ <input type="text"/>

સિનિયર
૧૬ થી ૨૧ <input type="text"/>

માસ્ટર
૨૨ થી ૨૯ <input type="text"/> ૩૦+ <input type="text"/>

### સંમતિ પત્રક

તારીખ : \_\_\_\_\_

આથી હું મારા પાલ્ય ચિ \_\_\_\_\_ (પુરુ નામ)ને તારીખ ૨૧-૧૧-૨૦૧૧ થી ૨૩-૧૨-૨૦૧૧ યોજાનાર સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટેની સંમતિ આપું છું. આ દરમ્યાન મારા પુત્ર/પુત્રીને કોઈપણ જાતની ઈજા/બીમારી/મુશ્કેલી થાય તો તેની સંપૂર્ણ જવાબદારી મારી પોતાની રહેશે.

પિતા /વાલીની \_\_\_\_\_

સરનામું \_\_\_\_\_

તારીખ સાથે સહી \_\_\_\_\_

મોબાઈલ નં. \_\_\_\_\_

### નોંધ :-

- બાળકના આઈડ્યુ સર્ટિફિકેટની નકલ ફોર્મ સાથે જોડવાની રહેશે.
- વિભાગ ૧ થી ૬ માંથી, કોઈપણ એક જ વિભાગની રમત પસંદ કરવાની રહેશે.
- વિભાગ ૧ થી ૫ માંથી, કોઈપણ એક વિભાગમાંથી બે રમતો પસંદ કરવાની રહેશે.
- વિભાગ ૬ માં માત્ર એક જ ગેમ પસંદ કરી શકાશે.
- પાવરલિફ્ટીંગ રમતમાં માત્ર ૧૬ વર્ષ કે તેથી ઉપરની ઉંમરના જ બાળકો ભાગ લઈ શકશે.
- ક્રિકેટ અને પાવરલિફ્ટીંગ આ બંને રમતોમાં ફક્ત ભાઈઓ જ ભાગ લઈ શકશે.
- બાળક જો વિભાગ ૬ની રમતોમાં ભાગ લે તો તે સિવાયના બીજા કોઈપણ વિભાગની રમતમાં બાળક ભાગ લઈ શકશે નહીં.
- જો એક કરતા વધારે વિભાગોમાંથી રમત પસંદ કરવામાં આવી હશે તો તેને કઈ રમતમાં ભાગ લેવાડાવવો એ રાજ્ય-ઓફિસ દ્વારા નક્કી કરવામાં આવશે, જેમાં પાછળથી કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
- આઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના સ્કૂલમાં ન ભણતા બાળકો કે વ્યક્તિઓ પણ આ રમોત્સવમાં ભાગ લઈ શકશે.
- ફોર્મ ભરીને જે-તે જીલ્લાના ગ્રોથ ધ ડેવલોપમેન્ટ મેનેજરને આપવાનું રહેશે.

ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ

તારીખ સાથે સહી

મોબાઈલ નં. : \_\_\_\_\_

સ્પોર્ટ ડાયરેક્ટરની

તારીખ સાથે સહી

મોબાઈલ નં. : \_\_\_\_\_

